storyweaver Community

જન્મદિવસની ભેટ

Author: Bhavik Raval
Illustrators: Angie & Upesh, Henu, Megha Vishwanath, Ouk Ratha, Rahul Kulkarni, Sharanya Singh, Srikrishna Kedilaya, Zainab Tambawalla

વાચન સ્તર ૧

અાજ સવારે ઉમંગ વહેલો જાગી ગયો.
તે ખુશ હતો અને ઝડપથી તૈયાર થઇ ગયો.

આજ તેનો જન્મદિવસ હતો.
તે વિચારતો હતો કે તેને આજ કઇ ભેટ મળશે!!!
તે ભેટનો વિચાર કરતાં કરતાં શાળાએ ગયો.

શાળામાં પણ તેણે તેના મિત્રો સાથે ખુબ મજા કરી.

ઘરમાં બધાએ તેને જન્મદિવસની શુભકામનાઓ આપી.

સાંજે બધાએ મળીને તેનાં જન્મદિવસની ઉજવણી કરી.
ઉમંગના કાકા અચાનક જ ઘરની બહાર ગયાં....

અને તેના માટે નવી સાયકલ લઇ આવ્યા..



કાકાએ તેને સાયકલ પર બેસાડી એક ચક્કર લગાવ્યું.
ઉમંગ સાયકલ પર ફરીને ખૂબ ખુશ હતો.

તે તેની બહેન સાથે સાયકલ પર બેસીને
ગીત ગાવા લાગ્યો

ટ્રીન....ટ્રીન... ટોકરી વાગે છે.
સરરરરર સાયકલ ચાલે છે.
હેતવી મારી સાથે છે...
ઝડપથી સાયકલ ચલાવે છે....

PRATHAM BOOKS storyweaver

This book was made possible by Pratham Books' StoryWeaver platform. Content under Creative Commons licenses can be downloaded, translated and can even be used to create new stories - provided you give appropriate credit, and indicate if changes were made. To know more about this, and the full terms of use and attribution, please visit the following link.

Story Attribution:

This story: જન્મદિવસની ભેટ is written by Bhavik Raval . © Bhavik Raval , 2017. Some rights reserved. Released under CC BY 4.0 license.

Images Attributions:

Cover page: A boy opening gifts after a party, by Megha Vishwanath © Storyweaver, Pratham Books, 2015. Some rights reserved. Released under CC BY 4.0 license. Page 2: Boy yawning, Boy looking confused, by Angie & Upesh © Pratham Books, 2010. Some rights reserved. Released under CC BY 4.0 license. Page 3: A boy, by Srikrishna Kedilaya © Pratham Books, 2004. Some rights reserved. Released under CC BY 4.0 license. Page 4: Three children in school, by Ouk Ratha © The Asia Foundation, 2016. Some rights reserved. Released under CC BY 4.0 license. Page 5: Family, by Sharanya Singh © Sharanya Singh, 2018. Some rights reserved. Released under CC BY 4.0 license. Page 6: Birthday party, by Megha Vishwanath © Storyweaver, Pratham Books, 2015. Some rights reserved. Released under CC BY 4.0 license. Page 7: Someone riding a cycle and ringing its bell, by Zainab Tambawalla © Pratham Books, 2011. Some rights reserved. Released under CC BY 4.0 license. Page 8: Man helping boy cycle, by Henu © Pratham Books, 2010. Some rights reserved. Released under CC BY 4.0 license. Page 9: Boy Cycling, by Rahul Kulkarni © Rahul Kulkarni, 2018. Some rights reserved. Released under CC BY 4.0 license. Page 10: Cycling Boy and Girl, by Rahul Kulkarni © Rahul Kulkarni, 2018. Some rights reserved. Released under CC BY 4.0 license.

Disclaimer: https://www.storyweaver.org.in/terms_and_conditions

Some rights reserved. This book is CC-BY-4.0 licensed. You can copy, modify, distribute and perform the work, even for commercial purposes, all without asking permission. For full terms of use and attribution, http://creativecommons.org/licenses/by/4.0/

જન્મદિવસની ભેટ

(Gujarati)

જન્મદિવસ, ભેટ, મજા, ઉજવણી, કાકા, સાયકલ, બહેન, ગીત

પહેલા સ્તરની આ ચોપડી વાંચવાનો આરંભ કરવા ઉત્સુક બાળકો માટે છે.

PRATHAM BOOKS storyweaver

Pratham Books goes digital to weave a whole new chapter in the realm of multilingual children's stories. Knitting together children, authors, illustrators and publishers. Folding in teachers, and translators. To create a rich fabric of openly licensed multilingual stories for the children of India and the world. Our unique online platform, StoryWeaver, is a playground where children, parents, teachers and librarians can get creative. Come, start weaving today, and help us get a book in every child's hand!